

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૭/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૪૬૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૫ કેસ કરી ૧૫ વ્યક્તિઓને ઝડપી, ૬૨ લીટર દેશી દારૂ, ૩૦ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૨૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૪,૬૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૬૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૮૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૪૬૪/૧૭

ઈસનપુર: અનીતાબહેન વા/ઓફ ભોજરાજભાઈ કેવલાણી (ઉ.વ.૫૧) (રહે. કમલ પાર્ક સોસાયટી કેડિલા રોડ ઘોડાસર ઇસનપુર) તા.૧૬/૭/૧૭ સવારના ૬/૩૦ વાગ્યાના સુમારે ઇસનપુર ઘોડાસર ગામ હનુમાનજીના મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ અનીતાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ અનીતાબહેન કેવલાણીએ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.ડી.વૈશ્યક ચલાવે છે.

સાઈટ ઉપરથી પડી જતા મૃત્યુ:

સમાચાર યાદી નં.૧૪૬૫/૧૭

સાબરમતી: કનૈયાલાલ અનંતરાય શર્મા (ઉ.વ.૨૧) (રહે. યાણક્યપુરી સેક્ટર-૧) તા.૧૭/૭/૧૭ બપોરના સમયે ચેનપુર ફાટક પાસે આવેલ સાયોનાપીક સાઇડ પર કલર કામ કરતા હતા ત્યારે બાલ્કની માંથી પડી જતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે લાઇફ લાઇન હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રસિકભાઈ વિઠ્ઠલભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૪૬૬/૧૭

કૃષ્ણનગર: અંજલીબહેન વા/ઓફ ભુપેન્દ્રસિંહ ચૌહાણ (રહે. નવી ફોજદારની ચાલી હિરાવાડી કૃષ્ણનગર) એ અગમ્ય કારણસર તા.૧/૭/૧૭ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.